

PSL/CS/SE/REG-47/22-23 12th August, 2022

Corporate Relationship Department **BSE** Limited 1st Floor, P. J. Towers Dalal Street. Mumbai - 400 001.

#### COMPANY CODE NO:-4166 (SCRIP CODE: 513511)

Publication of extract of Unaudited Financial Results for the quarter ended 30th June, Sub:

Regulation 47 of the SEBI (LODR) Regulations, 2015. Ref:

Dear Sir,

Pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we enclose herewith the newspaper clippings of the extract of the Unaudited Financial Results of the Company for the quarter ended 30th June, 2022 published on 11th August, 2022 in Indian Express & Business Standard (English) and Financial Express & Loksatta-Jansatta (Gujarati).

You are requested to kindly take the above on your records.

Thanking You,

Yours faithfully For Panchmahal Steel Limited

Deepak Nagar

GM (Legal) & Company Secretary

E-mail: shares@panchmahalsteel.co.in

Encl: as above

panchmahal@panchmahalsteel.co.in

## Panchayat (R & B ) Division District Panchayat - Anand Tender Notice. No. 30 (2022-23)

The Tenders are in the ON LINE by Executive Engineer, District Panchayat (R & B) Division, At Borsad Chowkdi" Panchayat Bhavan Anand-388001. Phone No. 02692-260139 for the Road work under MMGSY- 01 (3rd Try) Estimated cost Rs. 70 lacs, Last date of online tender submission for all works is Dt.22/08/2022 18:00 hrs. Tenders will be available on website www.nprocure.com. Tender notice will also be available on Information Department's website www.statetenders.gujarat.gov.in The corrigendums will be made online only.

| No. | Package No                                | Approved Amount lacs | Tender Fee/<br>EMD Rs. | Category                        |
|-----|---|----------------------|------------------------|---------------------------------|
| 1   | AND/MMGSY/SCSP/WD/<br>2021-22/1 (3rd Try) | 70.00                | 2400<br>75600          | Class-B, Sp.<br>Road -3 & Above |
|     |   |                      |                        | (INF/ANAND/373/22-23)           |

# **BLOOM DEKOR LIMITED**

CIN: L20210GJ1992PLC017341

Read, Office: Block No. 267, Village Oran, Taluka Prantii, N. H. 8, Dist, Sabarkantha, North Guiarat-383 205 Corporate Office: 2/F, Sumel, S. G. Highway Road, Thaltej, Ahmedabad-380 059, Gujarat.

Tel. Phone: +91 – 79 – 2684 1916 / 17; Fax: +91 – 79 – 2684 1914

E-mail: redressal@bloomdekor.com; Website: www.bloomdekor.com

#### NOTICE OF THE 31<sup>st</sup> annual general meeting of THE COMPANY, BOOK CLOSURE, CUT OFF DATE AND E-VOTING

NOTICE is hereby given that, in view of the continuing Covid-19 pandemic and in accordance with the Circular No. 14/2020 dated April 08, 2020. Circular No.17/2020 dated April 13, 2020 issued by the Ministry of Corporate Affairs followed by Circular No. 20/2020 dated May 05, 2020 and Circular No. 02/2021 dated January 13, 2021, December 8, 2021, December 14, 2021 and May 05, 2022 (hereinafter collectively referred to as "MCA Circulars") issued by Ministry of Corporate Affairs ("MCA") for holding of Annual General Meeting through VC or OAVM without the physical presence of Members at a common venue, the Thirty first (31st) Annual General Meeting (AGM) of the Members of Bloom Dekor Limited will be held on Friday, September 2, 2022 at 11:00 A.M. IST through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") to transact the Ordinary Businesses and Special Businesses as set out in the notice of 31st AGM.

In accordance with the above mentioned MCA Circulars and SEBI Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 dated May 13, 2022, the Notice of 31st AGM along with Annual Report 2021-22 is being sent through electronic mode only to those Members whose email addresses are registered with the Company/ Depositories as on Friday, August 5, 2022. Member may note that Notice of 31st AGM and Annual Report 2021-22 have been uploaded on the website of the Company at www.bloomdekor.com, website of BSE Limited at www.bseindia.com and website of National Securities Depository Limited (NSDL) i.e. www.evoting.nsdl.com.

In light of the MCA Circulars, the shareholders whether holding equity shares in demat form or physical form and who have not submitted their email addresses and in consequence to whom the notice of 31st AGM and Annual Report 2021-22 could not be serviced, may temporarily get their e-mail addresses registered by following the procedure given below:

1. In case shares are held in physical mode, please provide Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back), PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) by email to redressal@bloomdekor.com.

2. In case shares are held in demat mode, please provide DPID-CLID (16 digit DPID + CLID or 16 digit beneficiary ID), Name, client master or copy of Consolidated Account statement, PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) by email to redressal@bloomdekor.com.

3. Alternatively member may send an e-mail request to evoting@nsdl.co.in for obtaining User ID and Password by proving the details mentioned in Poin (a) or (b) as the case may be.

Post successful registration of the e-mail address, the shareholder would get soft copies of notice of 31st AGM and Annual Report 2021-22 and the procedure for e-voting along with the user-id and the password to enable them for e-voting in respect of 31st AGM. In case of any queries, shareholder may write to the Company at redressal@bloomdekor.com. Shareholders are requested to register/ update their complete bank details and Email Ids with their Depository Participant(s) with whom they maintain their demat accounts if shares are held in dematerialized mode by submitting the requisite documents.

Members and Share Transfer Books of the Company will be The Register closed from Saturday, August 27, 2022 to Friday, September 2, 2022 (both days inclusive) for the purpose of Thirty first AGM and same will be re-opened from Saturday, September 3, 2022 onwards. Members whose names are recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the Depositories as on Friday, August 26, 2022("Cut-off date") shall only be entitled to avail the facility of remote e-voting as well as e-voting on the date of Annual General Meeting.

Pursuant to the provisions of Section 108 of the Companies Act, 2013 read with Rules made thereunder (as amended) and Regulation 44 of SEBI (LODR) Regulations, 2015 (as amended) and above mentioned MCA Circulars, the Company is providing facility of remote e-voting and e-voting on the date of the AGM to its Members in respect of the businesses to be transacted at the AGM. For this purpose, the Company has entered into an agreement with NSDL for facilitating voting through electronic means.

The remote e-voting will commence on 9:00 A.M. on Tuesday, August 30, 2022 and will end on 5:00 P.M. on Thursday, September 1, 2022. During this period, the members of the Company holding shares as on Cut-off date may cast their vote electronically (Remote E-Voting). Members may note that a) the remote e-voting module shall be disabled by NSDL after the aforesaid date and time for voting and once the vote on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently; b) the facility of e-voting shall be made available at the 31st AGM; and c) the members who have cast their vote by remote e-voting prior to the 31st AGM may also attend the 31st AGM but shall not be entitled to cast their vote again. Detailed procedure for remote e-voting/ e-voting is provided in the Notice of the 31st Annual General Meeting.

Any person, who acquires shares of the Company and become member of the Company after dispatch of the Notice of AGM and holding shares as on the cut-off date i.e. Friday, August 26, 2022, may obtain the login ID and password by sending a request at evoting@nsdl.co.in or redressal@bloomdekor.com. However, if you are already registered with NSDL for remote e-voting then you can use your existing user ID and password for casting your vote. If you forgot your password, you can reset your password by using "Forgot Password" option available on www.evoting.nsdl.com. In terms of SEBI circular dated December 9, 2020 on e-Voting facility provided by Listed Companies, Individual shareholders holding securities in demat mode are allowed to vote through their demat account maintained with Depositories and Depository Participants. Shareholders are required to update their mobile number and email ID correctly in their demat account in order to access e-Voting facility.

In case of any queries for e-voting, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on toll free no.: 1800 1020 990 and 1800 22 44 30 or send a request at evoting@nsdl.co.in. Members may also contact Mr. Tushar Donda. Company Secretary of the Company at the corporate office of the Company or may write an e-mail to redressal@bloomdekor.com or may call on 079 -2684 1916/17 for any further clarification.

Members can attend and participate in the Annual General Meeting through VC/OAVM facility only. The instructions for joining the Annual General Meeting are provided in the Notice of the Annual General Meeting. In case the shareholders/members have any queries or issues regarding participation in the AGM, you can write an email to evoting@nsdl.co.in or Call at: 1800 1020 990 and 1800 22 44 30. Members attending the meeting through VC/OAVM shall be counted for the purposes of reckoning the quorum under Section 103 of the Companies Act, 2013.

For, Bloom Dekor Limited

**Tushar Donda** Place: Ahmedahad Date: August 10, 2022 **Company Secretary** 



## **TAMIL NADU HOUSING BOARD CHENNAI CIRCLE**



Dated: 10.08.2022

**TENDER NOTICE** 

TENDER NOTICE NO: CC/05/2022-23

Sealed tenders with Pre-Qualification system duly superscribed on the covers with Name of Work, reference No, due date and Name of Tenderer are invited for the following works so as to reach the office of the Superintending Engineer (Chennai Circle), Tamil Nadu Housing Board, Chennai-600 035 upto 11.00 A.M (as per office clock) on the due dates mentioned below. The tenders will be opened by the undersigned at his office at 11.30 A.M on the same day in the presence of the tenderer or their agent who choose to be present.

| SI.<br>No. | Description of work   | Approximate<br>value<br>(Rs. in Crores) | EMD<br>in Rupees |
|------------|---|---|------------------|
| 1          | 2   | 3                                       | 4                |
| 1.         | Construction of 80 HIG flats (Stilt + 5 floors) of 4 Blocks with one Amenities Block in S.No.251/1, Padikuppam Village, Ambattur Taluk, Chennai District under self finance scheme. | 53.78<br>(+GST 12%)                     | 26,99,000/-      |

Last date & time for receipt & Opening of tender on 16.09.2022 upto 11.00 A.M &11.30 A.M respectively. Period for sale Upto 15.09.2022 Upto 1.00 P.M Cost of tender document is Rs.15.750/-. The tender document can be downloaded www.tender.tn.gov.in at free of cost. The tender notice & other Conditions details can be had from Superintending Engineer/Chennai Circle, Anna Salai, Nandanam, Chennai-35.

485,MTB Building, Anna Salai, Nandanam, Chennai-600035. Ph.No.044-24322070

Chennai Circle DIPR/ 3724 /TENDER/2022 "சோதனை கடந்து சுதந்திரம் அடைந்தோம், சாதனை புரிந்து சரித்திரம் படைப்போம்"

SUPERINTENDING ENGINEER (i/c)



Registered Office : "Trishul" 3<sup>rd</sup> Floor, Opp. Samartheshwar Temple, Law Garden, Ellisbridge, Ahmedabad-380 006. CIN: L65110GJ1993PLC020769 Tel No.: 079-66306161 Fax No.: 079-26409321

## Email: shareholders@axisbank.com Website: www.axisbank.com **NOTICE FOR LOSS OF SHARE CERTIFICATES**

Notice is hereby given that the certificates in respect of the under mentione Equity Shares of Axis Bank Limited have been lost / misplaced and the holders of the said Shares have applied to Axis Bank Limited for issue of duplicate share certificates in lieu of the original share certificates.

| Sr. | Name of Shareholder(s) | Folio No.          | No.of  | Cert.  | Dist.   | Nos.    |
|-----|------------------------|--------------------|--------|--------|---------|---------|
| No. |                        |                    | Shares | No.    | From    | То      |
| 1.  | IFTIKHAR ALAM          | UTI113435          | 500    | 508095 | 7372866 | 7373365 |
| 2.  | MANJU KHADSE           | UTI044154          | 500    | 500550 | 652166  | 652665  |
| 3   | PANKAJ PANCHAMIA       | UT <b>I</b> 098770 | 1000   | 509936 | 8940031 | 8941030 |

Any person having claims/objections in respect of the said Shares, should communicate to the Bank at the Registered Office or Bank's Registrar and Share Transfer Agent at the address given below, within 15 (Fifteen) days from the date of this advertisement, else the Bank will proceed to issue letter of confirmation after expiry of 15 (Fifteen) days.

Registrar and Share Transfer Agent: Kfin Technologies Limited Unit: Axis Bank Limited Karvy Selenium Tower-B. Plot 31-32, Gachibowli, Financial District, Nanakramguda, Hyderabad-500 032. Email: einward.ris@kfintech.com Toll Free No. 1800-390-4001

FOR AXIS BANK LIMITED

DATE: 10-08-2022 PLACE: MUMBAI

Sandeep Poddar **Company Secretary** 



Registered Office: GIDC Industrial Estate, Kalol-389 330, Dist. Panchmahals. Guiarat CIN: L27104GJ1972PLC002153. Phone No: 02676-230777. Fax No: 02676-230889 Email: shares@panchmahalsteel.co.in Website: www.panchmahalsteel.co.in

|   | EXTRACT OF UNAUDITED FINANCIAL RES | SULTS FOR THE QUARTER ENDED 30 <sup>™</sup> JUNE, 2022 |
|---|------------------------------------|--|
| Ì |                                    | ₹ in Lacs  |

|     |  |              |              |              | ₹ in Lacs      |
|-----|--|--------------|--------------|--------------|----------------|
| Sr. |  |              | Year ended   |              |                |
| No. | Particulars  | 30.06.2022   | 31.03.2022   | 30.06.2021   | 31.03.2022     |
|     |  | (Unaudited)  | (Audited)    | (Unaudited)  | (Audited)      |
| 1   | Total Income   | 13,515.08    | 14,452.81    | 9,143.67     | 57,760.94      |
| 2   | Net Profit / (Loss) for the period (before Tax,<br>Exceptional and/or Extraordinary items)   | 1352.16      | 1987.26      | 634.80       | 6655.06        |
| 3   | Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)   | 1352.16      | 1987.26      | 634.80       | 6655.06        |
| 4   | Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)  | 985.53       | 1480.00      | 634.80       | 5858.22        |
| 5   | Total Comprehensive Income for the period [comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)] | 982.52       | 1444.91      | 637.82       | 5829.91        |
| 6   | Equity Share Capital   | 1907.83      | 1907.83      | 1908.31      | 1907.83        |
| 7   | Reserves excluding Revaluation Reserve   | 14088.27     |              |              |                |
| 8   | Earnings Per Share (of ₹ 10/- each)<br>(for continuing and discontinued operations)<br>a) Basic<br>b) Diluted                                | 5.17<br>5.17 | 7.76<br>7.76 | 3.33<br>3.33 | 30.71<br>30.71 |

The above is an extract of the detailed format of Quarterly Unaudited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Unaudited Financial Results for the first guarter ended on 30th June, 2022 are available on the website of Stock Exchange at www.bseindia.com and also on the Company's website at www.panchmahalsteel.co.in

For Panchmahal Steel Limited

Place: Vadodara Date: 10th August, 2022

Ashok Malhotra Chairman & Managing Director DIN - 00120198

## MADHYA PRADESH JAL NIGAM MARYADIT

(A Govt. of Madhya Pradesh Undertaking) "D" Wing, 2nd Floor, Vindhyachal Bhawan, Bhopal - 462004 Ph.: 0755-2579034, 2579874 || Fax: 0755-2579873 www.mpjalnigam.mp.gov.in || E-mail : mpjalnigam@mp.gov.in CIN - U41000MP2012SGC028798

NIT No. 91-99/Proc./MPJNM/2022-23 Bhopal, Dated: 10.08.2022

## **NOTICE INVITING E-TENDER**

Online Lump-sum rate bids for execution of following Multi Villages Scheme (MVS) are invited from Registered Contractors/firms fulfilling eligibility criteria as specified in tender document. Basic details of MVS are as follows:

| NIT<br>No. | Scheme<br>(MVS)       | District           | Total<br>Villages<br>(including<br>Bulk<br>Supply<br>Villages) | Bulk<br>Supply<br>Villages | PAC<br>(Rs.<br>Cr.) | EMD<br>(Rs.<br>Lakh) | Cost of<br>Tender<br>Document<br>(Rs.) | Time for<br>Completion<br>(including<br>rainy<br>season)<br>(months) |
|------------|-----------------------|--------------------|--|----------------------------|---------------------|----------------------|--|--|
| 91         | Machagora             | Chhindwara         | 711  | 486                        | 748.50              | 50.00                | 50,000                                 | 24   |
| 92         | Bebus<br>Sunar 2      | Chhatarpur & Damoh | 351  | 101                        | 463.68              | 50.00                | 50,000                                 | 24   |
| 93         | Kutne<br>Rajnagar     | Chhatarpur         | 133  | 5                          | 274.02              | 50.00                | 50,000                                 | 24   |
| 94         | Meda                  | Betul              | 241  | 197                        | 257.98              | 50.00                | 50,000                                 | 24   |
| 95         | Chatarpur<br>(Tarped) | Chhatarpur         | 139  | 5                          | 241.19              | 50.00                | 50,000                                 | 24   |
| 96         | Garoli                | Chhatarpur         | 112  | 8                          | 198.44              | 50.00                | 50,000                                 | 24   |
| 97         | Bebas<br>Sunar 1      | Damoh &<br>Sagar   | 93   | 27                         | 134.84              | 50.00                | 50,000                                 | 24   |
| 98         | Wardha                | Betul              | 92   | 63                         | 107.28              | 50.00                | 50,000                                 | 24   |
| 99         | Gada                  | Betul              | 49   | 45                         | 56.67               | 28.34                | 50,000                                 | 24   |

Interested bidders can view/download/purchase the bid document online from M.P. Government E-Procurement Portal from 12.08.2022, 18:00 Hrs. Bidding process dates mentioned as critical dates on M.P. Government E-Procurement Portal will be applicable. Corrigendum/Addendum in NIT, if any, would be published on portal only and not in newspapers.

M.P. Government E-Procurement Portal - https://mptenders.gov.in MANAGING DIRECTOR M.P. Madhyam/105919/2022

# **VEERAM SECURITIES LIMITED**

CIN: L65100GJ2011PLC064964 Address: Ground & First Floor, 7, Natvarshyam Co Op Ho S Ld Opp. Orchid Park, Ramdevnagar Road, Sattelite, Ahmedabad-380051 Email id: compliancingveeram@gmail.com

#### EXTRACT OF UNAUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30.06.2022 Quarter ended on Year Ended 30.06.2022 | 31.03.2022 | 30.06.2021 31.03.2022 **Particulars** Unaudited Audited Unaudited Audited 194.37 2051.50 Total Income 369.65 Net Profit for the year before tax 100.04 95.52 86.47 448.52 80.04 80.52 86.47 398.52 Net Profit for the year after tax Total Comprehensive Income for the year 80.04 80.52 86.47 398.52 1008.54 1008.54 1008.54 1008.54 Paid up Equity Share Capital Other Equity Excluding Revaluation Reserve Earnings per share (Face Value of Rs. 2/- each)

Diluted

1) The above Financial Results were reviewed by the Audit Committee and Approved by the Board of Directors at their respective Meetings held on 10th August, 2022.

(2) The Statutory Auditors have carried out Limited Review of the above standalone financial results for the guarter ended on June 30, 2022 as required under Regulation 33 of SEBI (Listing Obligations & Disclosure Requirements)

0.16

0.16

Regulations, 2015. 3) The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the

same is available on the websites of the Stock Exchange and the listed entity. 4) Previous periods figures have been regrouped/reclassified where considered necessary to conform to current period's

FOR AND ON BEHALF OF **VEERAM SECURITIES LIMITED** 

0.16

0.16

0.17

0.79

0.79

Mahendrabhai Ramniklal Shah Date: 10.08.2022 Managing Director (DIN: 03144827)

# UNITED POLYFAB GUJARAT LIMITED

CIN: L18109GJ2010PLC062928

Regd Office: Survey No. 238, 239, Shahwadi, Opp. New aarvee Denim, Narol-Sarkhej Highway, Ahmedabad-382 405 Gujarat, India • Tel No: -+91-079-25731155 • Website:www.upgl.in • Email-info@unitedpolyfab.com

Extract of Standalone Unudited Financial Results for the Quarter Ended on June 30, 2022 Quarter Quarter ended on ended on ended on ended on **Particulars** 30/06/2022 31/03/2022 30/06/2021 31/03/2022 Unaudited Audited Unaudited Audited Total Income From Operations 17017.92 16626.82 12747.42 66144.79 Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/o 197.90 325.33 141.64 1215.22 Extraordinary items) 156.90 591.37 454.66 214.28 Net Profit/(Loss) for the period before tax (after Exceptiona and/or Extraordinary items) Net Profit/(Loss) for the period after tax (after Exceptional 189.93 150.96 940.46 and/or Extraordinary items) Total Comprehensive Income for the period [Comprising Profit / 255.64 170.65 956.74 150.96 (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)1 **Equity Share Capital** 2095.16 2095.16 Other Equity 3416 08 Earnings Per Share (of Rs 10/- each) (for continuing and discontinued operations)-Basic: (not annualzed for the quarter ended) 1.22 0.91 0.72 4.49 Diluted:(not annualzed for the quarter ended) 1.22 0.91 4.49

Note:- The above financial is an extract of the detailed format of quarterly Financial Results filed with the National Stock Exchange (NSE Ltd.) under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulation, 2015. The full format of the quarterly Financial Results are available on the National Stock Exchange Website at www.nseindia.com and Company's website at www.upgl.in For, United Polyfab Gujarat Limited

GAGAN NIRMALKUMAR MITTAL CHAIRMAN & MANAGING DIRECTOR Date: August 10, 2022 DIN: 00593377



Bandhan | Regional Office: Netaji Marg, Nr. Mithakhali Six Roads, Ellisbridge, Ahmedabad-6. Phone: +91-79-26421671-75

# **Demand Notice to Borrowers**

The under mentioned account turned into N.P.A and demand notice is issued by Bandhan Bank Ltd. to the following borrower(s) under sec.13(2) of the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act (The Act), 2002 which was returned unserved. Hence, this notice is issued to you all and public at

| arge through publication.  |   |   |   |  |  |  |
|--|---|---|---|--|--|--|
| Description of mortgaged property (Secured Asset)                | Date of Demand  | O/S Amount as on Date   | Date of Pasting   |  |  |  |
|  | Notice/ Date of NPA   | of Demand Notice  | of Notice   |  |  |  |
| All that piece and parcel of the immovable property situated at  | 18.07.2022/   | Rs.73,23,292.81   | 08.08.2022  |  |  |  |
| Revenue Survey No. 184/1, TPS No. 1, Final Plot No. 184 to       | 04.06.2022  |   |   |  |  |  |
| 187, Plot No. 52, land area admeasuring 121.87 Sq. Mts.,         |   |   |   |  |  |  |
| Bhavna Society, B/h Tulsi Dining Hall, 80 Feet Road, Veraval,    |   |   |   |  |  |  |
| Dist Gir, Somnath, Gujarat- 362266 and bounded by:               |   |   |   |  |  |  |
| North: Old/Final Plot No. 119/4 Land, East: Road, West: Plot No. |   |   |   |  |  |  |
| 53 property, South: Plot No. 39 property                         |   |   |   |  |  |  |
|  | Bhavna Society, B/h Tulsi Dining Hall, 80 Feet Road, Veraval,<br>Dist Gir, Somnath, Gujarat- 362266 and bounded by:<br>North: Old/Final Plot No. 119/4 Land, East: Road, West: Plot No. | All that piece and parcel of the immovable property situated at Revenue Survey No. 184/1, TPS No. 1, Final Plot No. 184 to 18.07.2022/04.06.2022  187, Plot No. 52, land area admeasuring 121.87 Sq. Mts., Bhavna Society, B/h Tulsi Dining Hall, 80 Feet Road, Veraval, Dist Gir, Somnath, Gujarat- 362266 and bounded by:  North: Old/Final Plot No. 119/4 Land, East: Road, West: Plot No. | All that piece and parcel of the immovable property situated at Revenue Survey No. 184/1, TPS No. 1, Final Plot No. 184 to 187, Plot No. 52, land area admeasuring 121.87 Sq. Mts., Bhavna Society, B/h Tulsi Dining Hall, 80 Feet Road, Veraval, Dist Gir, Somnath, Gujarat- 362266 and bounded by: North: Old/Final Plot No. 119/4 Land, East: Road, West: Plot No. |  |  |  |

Demand made against you through this notice to repay to the Bank dues mentioned against your name with interest, costs and charges within 60 days from the date hereof, failing which the Bank will further proceed to take steps u/s.13(4) of the SARFAESI Act. The borrowers'/mortgagors' attention is invited to the provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

Date: 11/08/2022

**Authorised Officer Bandhan Bank Limited** 

# oose substance over sensation.

# **ALEMBIC LIMITED** CIN: L26100GJ1907PLC000033

Alembic: Regd.Office: Alembic Road, Vadodara - 390 003 Tel: 0265-2280550 Website: www.alembiclimited.com Email: alembic.investors@alembic.co.in

#### **Extract of Statement of Consolidated Unaudited Financial Results** for the Quarter ended 30th June, 2022

| (₹ in Lacs except per share data)   |  |  |                                     |  |  |  |
|---|--|--|-------------------------------------|--|--|--|
|   | Consolidated                             |  |                                     |  |  |  |
| Particulars   | Quarter Ended<br>30.06.2022<br>Unaudited | Quarter Ended<br>30.06.2021<br>Unaudited | Year Ended<br>31.03.2022<br>Audited |  |  |  |
| Total Income from Operations  | 2,280                                    | 2,278                                    | 16,740                              |  |  |  |
| Net Profit for the period (before Tax,<br>Exceptional and/or Extraordinary items)                     | 434                                      | 481                                      | 9,786                               |  |  |  |
| Net Profit for the period before Tax (after Exceptional and/or Extraordinary items)                   | 434                                      | 481                                      | 9,786                               |  |  |  |
| Net Profit for the period after Tax<br>(after Exceptional and/or Extraordinary items)                 | 385                                      | 384                                      | 8,619                               |  |  |  |
| Total Comprehensive Income / (Loss) for the period  | (8,237)                                  | 62                                       | 32,891                              |  |  |  |
| Equity Share Capital  | 5,136                                    | 5,136                                    | 5,136                               |  |  |  |
| Reserves (excluding Revaluation Reserve)<br>as shown in the Audited Balance Sheet of<br>previous year | -  | -  | 1,89,567                            |  |  |  |
| Earning Per Share (of ₹ 2/- each) Basic & Diluted   | (0.72)                                   | 1.91                                     | 8.65                                |  |  |  |
| Note  |  |  |                                     |  |  |  |

| Standalone details:    |               |               |            |  |  |
|------------------------|---------------|---------------|------------|--|--|
| Particulars            | Quarter Ended | Quarter Ended | Year Ended |  |  |
| Farticulars            | 30.06.2022    | 30.06.2021    | 31.03.2022 |  |  |
|                        | Unaudited     | Unaudited     | Audited    |  |  |
| Income from Operations | 2,184         | 2,235         | 16,506     |  |  |
| Profit Before Tax      | 403           | 471           | 9,728      |  |  |
| Profit After Tax       | 363           | 375           | 8,571      |  |  |

2. The above is an extract of the detailed format of financial results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the financial results are available on the Company's website at www.alembiclimited.com and on Stock Exchange's website at www.nseindia.com and www.bseindia.com

For Alembic Limited

Place: Vadodara Date: 10th August, 2022 Chirayu Amin Chairman

# બજાજ હાઉસિંગ ફાચનાન્સ લીમીટેડ

**કોર્પોરેટ ઓફીસ** : કેરેબ્રુમ આઇટી પાર્ક બીર બિલ્ડીંગ પાંચમો માળ, કલ્યાણી નગર, પુણે, મહારાષ્ટ્ર-૪૧૧૦૧૪. **શાખા ઓફીસ** : ચોથો માળ, ઔરમ પ્રેવન્યુ, મેચર બંગલોઝ સામે, લૉ ગાર્ડન પાસે, એલિસબ્રિબ, અમદાવાદ–૩૮૦૦૦ફ **શાખા ઓફીસ** : ઓફીસ નં. ૪૦૨, ચોથો માળ, આસ્થા કોર્પોરેટ કેપિટલ, વીઆઇપી રોડ, ભરથાણા સુરત–૩૯૫૦૦૭ **અને** ચોથો માળ, ઔરમ એવન્યુ, મેચર બંગલોઝ સામે, લોગાર્ડન પાસે, એલિસબ્રિબ, અમદાવાદ–૩૮૦૦૦ફ

# કબજા નોટીસ

સિક્યોરીટાઇઝેશન અને રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ની કલમ ૧૩(૪) હેઠળ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨નો નિયમ ૮ (૧). (પરિશિષ્ટ ૪)

જત જણાવવાનું કે મેસર્સ બજાજ હાઉસિંગ ફાયનાન્સ લીમીટેડ (બીએચએફએલ) ના નીચે સહી કરનાર અધિકૃત અધિકારીએ સિક્યોરીટાઇઝેશન અને રીકન્સ્ટ્રક્શન ઓફ ફાચનાન્સિયલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ હેઠળ અને સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ 3 સાથે વંચાતી કલમ ૧૩(૨) હેઠળ મળેલ સત્તાનો ઉપયોગ કરીને અહીં નીચે જ્યાવેલ દેવાદાર(રો)/સહ-દેવાદારો/જામીનદાર(રો) ને સદરહું નોટીસમાં જ્યાવેલ નોટીસ મળ્યાની તારીખથી ૬૦ દિવસની અંદર નોટીસમાં જ્યાવેલ રકમ ચુકવી જવા માટે માંગણા નોટીસ જારી કરી હતી. દેવાદાર(રો)/સહ–દેવાદારો/ જામીનદાર(રો) રકમની પુર્નચુકવણી કરવામાં નિષ્ફળ ગર્યો છે, પરિણામે દેવાદાર(રો)/સહ–દેવાદારો/જામીનદાર(રો)અને જાહેર જનતાને અહીં નોટીસ આપવામાં આવે છે કે મેસર્સ બજાજ હાઉસિંગ ફાયનાન્સ લીમીટેડના વતી નીચે સહી કરનારે સદરહું નિયમોના નિયમ ૮(૧) સાથે વંચાતા સદરહું કાયદાની કલમ ૧૩(૪) હેઠળ પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરીને અહીં નીચે જણાવેલ મિલકતનો કબજો મેળવી લીધો છે. પરિણામે ખાસ કરીને દેવાદાર(રો)/સહ–દેવાદારો/જામીનદાર(રો) અને જાહેર જનતાને નીચે જણાવેલ મિલકત સાથે સોદો ન કરવા સાવધ કરવામાં આવે છે અને જણાવેલ મિલકત સાથેનો કોઇપણ સોદો બીએચએકએલની અહીં જણાવેલ રકમ(મો) અને તેના પરના ચડત વ્યાજના પ્રથમ ચાર્જને આદ્યન રહેશે.

| (લોન નં.: 428TOL90586860, 428HSO90445906) ૧. દેવન્દ્ર કુમાર (દેવાદાર) ૨. સીમા (સહ—દેવાદાર) તમામનું સરનામું : સી–ર/૧૦૩, રવરતીક રેસિડેન્સી, પારડી કાંસડ ગુજરાત–૩૯૪૨૩૦ ચાખા : સિદ્ધપુર (લોન નં : 149ECN0384084) ૧. કિશોર અશોકનુમાર હિરવાણી (સહ—દેવાદાર) ૨. જ્યોતિ કિશોરભાઇ હિરવાણી (સહ—દેવાદાર) તમામનું સરનામું : ગુરુનાનક સોસાચટી, રાજપુર રોડ, સિદ્ધપુર–૩૮૪૧૫૧ ચાખા : હળવદ (લોન નં : 5E9RMSEJ137905) ૧. મચુસ્કુમાર અનિલભાઇ ડાંગર (દેવાદાર) ૨. દામુળેન અનિલભાઇ ડાંગર | કાઉન્ટ નંબર, શાખાનું નામ) (ર   |  | માંગણા<br>નોટીસની<br>શેખ અને રકમ  | કબજાની<br>તારીખ        |
|---|--|--|---|------------------------|
| (લોન નં : H49ECN0384084) ૧. કિશોર અશોકકુમાર હિરવાણી (દેવાદાર) ૨. જ્યોતિ કિશોરભાઇ હિરવાણી (સહ—દેવાદાર) તમામનું સરનામું : ગુરુનાનક સોસાચટી, રાજપુર રોડ, સિંહ્યુર–૩૮૪૧૫૧  શાખા : હળવદ (લોન નં : 5E9RMSEJ137905) ૧. મચુરકુમાર અનિલભાઇ ડાંગર (દેવાદાર) ૨. દામુળેન અનિલભાઇ ડાંગર (જેલો –મોરળી, ગુજરાત–૩૬૩૩૩૦, પુર્વ : રોડ, મુકામ–સચુર નગર તાલુકો–હળવદ (દેવાદાર) ૨. દામુળેન અનિલભાઇ ડાંગર  | 28TOL90586860,<br>45906)<br>માળ, બિલ્ડીંગ ન<br>સ્વામીનારાચણ<br>ક-દેવાદાર) તમામનું સરનામું :<br>ભ્વસ્તીક રેસિડેન્સી, પારડી કાંસડ<br>ત-૩૯૪૨૩૦                  | સ્તીક રેસિડેન્સી પાસે,<br>ડી કાંડે સચિન સુરત (રૂપિ<br>લાખ<br>ત્રણ  | <b>૧૯,ઝ,૩૧૬/–</b><br><b>૧૯,ઝ્ઝ,૩૧૬/–</b><br>પેચા ઓગણીસ<br>. સીત્ચોતેર હજાર<br>ણસો સોળ પુરા) | 9505.20.40             |
| (લોન નં : 5E9RMSEJ137905) તમામ ભાગ અને હિસ્સા : મચુર નગર ગામતળ વ્રા.<br>૧. મચુસ્કુમાર અનિલભાઇ ડાંગર આકારણઇ રજીસ્ટર્ડ મિલકત નં. ૪૧૧ હનુમાન (સૃ્દિ<br>(દેવાદાર) મંદિર રોડ મુકામ-મચુર નગર તાલુકો-હળવદ<br>૨. દામુબેન અનિલભાઇ ડાંગર જિલો–મોરળી, ગુજરાત–૩૬૩૩૩૦, પુર્વ : રોડ,  | 49ECN0384084) તમામ ભાગ અ<br>શોકન્કુમાર હિરવાણી (દેવાદાર) શોપિંગ સેન્ટર<br>શોરભાઇ હિરવાણી<br>ર) પ્લોટ, પશ્ચિમ : ક<br>નામું : ગુરુનાનક સોસાચટી, ગોપ ને ૨૦૬ દે  | એ/૧૯, હિરા પજ્ઞા<br>ટ ચાર્ડ, સ્ટેશન રોડ<br>૩૮૪૧૫૧, પુર્વ : ખુલો<br>૫૨૨   | ૦ <b>૭–મે–૨૦૨૨</b><br>. <b>૧,૫૦,૨૮૪/–</b><br>પિચા એક લાખ<br>ાસ હજાર બસ્સો<br>થૌર્ચાશી પુરા) | \$\$0\$.30.40          |
| (સહ-દેવાદાર) પશ્ચિમ:દેવદાનભાઇ ખીમાભાઇની મિલકત, ઉત્તર : ઝવાભાઇ ટપુભાઇનો પ્લોટ, દક્ષિણ : કેવદાનભાઇ ખીમાભાઇની મિલકત. દેવદાનભાઇ ખીમાભાઇની મિલકત.  | E9RMSEJ137905) તમામ ભાગ અ<br>ર અનિલભાઇ ડાંગર આકારણઇ રજી<br>મંદિર રોડ મુકા<br>બનિલભાઇ ડાંગર જિલો–મોરબી,<br>પશ્ચિમ : દેવદાન<br>જામું : મચુરનગર હળવદ– : જીવાભાઇ | મચુર નગર ગામતળ<br>ત નં. ૪૧૧ હનુમાન<br>ગર તાલુકો–હળવદ<br>દુ૩૩૩૦, પુર્વ : રોડ,<br>તાઇની મિલકત,ઉત્તર<br>પ્લોટ, દક્ષિણ :<br>મેલકત. | ઝ-મે–૨૦૨૨<br>. ઝ,૪૦,૮૨૩/–<br>પેચા સાત લાખ<br>ોસ હજાર આઠસો<br>ત્રેવીસ પુરા)                  | \$\$0\$. <b>20.</b> Po |

# Fullerton India

# ફુલર્ટન ઇન્ડિયા ક્રેડિટ કંપની લીમીટેડ કોર્પોરેટ ઓફીસ: સુપ્રિમ બિઝનેસ પાર્ક, ૫ અને ૬ માળ, બી વિંગ, પવાઇ, મુંબઇ-૪૦૦ ૦૭૬

(સ્થાવર મિલકત માટે)(સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૮ (૧) હેઠળ) આથી કુલર્ટન ઇન્ડિયા ક્રેડિટ કંપની લીમીટેડ (અહી પછી એફઆઇએચએફસીએલ તરીકે દર્શાવેલ છે) જે તેની રજીસ્ટર્ડ ઓફીસ મેઘ ટાવર્સ, ત્રીજો માળ, જુંનો નં. ૩૦૦ નવો નં. ૧૬૫, પુનામલી હાઇ રોડ, મધુરાવોચલ, ચેજ્ઞાઇ, તામિલનાડુ –૬૦૦૦૯૫ અને કોર્પોરેટ ઓફીસ–૫મો અને છક્કો માળ, બી વિંગ, સુપ્રિમ આઇટી પાર્ક, સુપ્રિમ સીટી લેક કેસ્ટલ પાછળ, પોવાઇ, મંબઇ-૪૦૦૦૭૬ ના નીચે સહી કરના અધિકાર અધિકારીએ સિક્યોરીટાઇગ્રેશન અને રીકન્સ્ટક્શન ઓર્ક કાયનાન્સિયલ એસેટસ અને એન્ફોર્સમેન્ટ ઓર્ફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ (૨૦૦૨ નો ૫૪<sup>)</sup> અને સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ 3 સાથે વંચાતી કલમ ૧૩(૧૨) હેઠળ મળેલ સત્તાનો ઉપયોગ કરીને નીચે જ્ણાવેલ તારીખે માંગણા નોટીસ જારી કરી નીચેના દેવાદારોને જ્ણાવેલ નોટીસમાં દર્શાવેલ રકમ જણાવેલ નોટીસ પ્રાંચાની તારીખથી ૬૦ દિવસની અંદર ચુક્વવા જણાવ્યું હતું.

નીસે જણાવેલ દેવાદાર રકમની પરત ચુકવાણી કરવામાં નિષ્ફળ ગયા હોવાથી, આથી નીસે જણાવેલ દેવાદારો અને જાહેર જ્નતાને જાણ કરવામાં આવે છે કે નીસે સહી કરનારે સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૮ સાથે વંચાતી એક્ટની કલમ ૧૩ ની પેટા કલમ (૪) હેઠળ મને મળતી સત્તાનો ઉપયોગ કરીને નીરો દર્શાવેલ મિલકતનો કબજો લઇ લીધો છે.

|  |  | 10 8   |                               |
|--|--|--|-------------------------------|
| દેવાદાર/સહ–દેવાદાર/ જામીનદારનું<br>નામ અને લોન એકાઉન્ટ નંબર  | <u>માંગણા નોટીસની તારીખ</u><br>બાકી રકમ  | સ્થાવર મિલકતની વિગત /<br>ગીરો મિલકત  | કબજાની તારીખ<br>કબજાનો પ્રકાર |
| 4) સાવન એન્જીનિચરિંગ<br>ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડ,<br>૨) રોનક મનસુખભાઇ<br>દોરાજીયા,<br>3) અંકુર ભરતભાઇ બદાણી,<br>૪) અંકિતા ચતુરભાઇ દેસાઇ,<br>૫) ખોડિદાસ નાનુભાઇ<br>ભેંસાણીયા,<br>દ્ ) સોનલબેન ખોડિદાસ<br>ભેંસાણીયા<br>લોન નંબર:<br>૧૭૩૬૦૧૩૧૦૪૩૧૯૫૧ અને<br>૧૭૩૬૦૩૯૧૦૪૫૮૯૧૪ | ૧૯.૦૬.૨૦૨૧<br>રૂ. ૯૮,૨૨,૪૯૩/–<br>(રૂપિયા અહાણું<br>લાખ બાવીસ હજાર<br>ચારસો ત્રાણું પુરા)   | સિક્ચોર્ડ એસેટ્સ ૧ : બંગલો નં. ૧૫, ક્ષેત્રફળ ૪૮.દૃ૪ ચો.મી.,<br>તેમજ બાંદાકામ "ૠષભ વિલા" સ્કીમ, સર્વે નં. ૪૨૫/૨, ટીપી<br>રકીમ નં. ૧૧૯, ફાઇનલ પ્લોટ નં. ૮૦/૨, મોજે–નિકોલ પેટા<br>જિલો–અમદાવાદ -૧૨ (નિકોલ) અને રજીર્ટ્ટ્રશન જિલો–<br>અમદાવાદ ખાતેની સ્થાવર મિલકતના તમામ ભાગ અને<br>હિસ્સા.<br>સિક્ચોર્ડ એસેટ્સ ૨ : ટેનામેન્ટ નં. ૧૬ ક્ષેત્રફળ દૃ૩ ચો.મી.<br>તેમજ બાંદાકામ "ૠષભ વિલા" સ્કીમ, સર્વે નં. ૪૨૫/૨, ટીપી<br>સ્કીમ નં. ૧૧૯, ફાઇનલ પ્લોટ નં. ૮૦/૨, મોજે–નિકોલ પેટા<br>જિલો–અમદાવાદ-૧૨ (નિકોલ) અને રજીર્ટ્યુશન જિલો–<br>અમદાવાદ ખાતેની સ્થાવર મિલકતના તમામ ભાગ અને<br>હિસ્સા. | <u>૦૫.૦૮.૨૦૨૨</u><br>ભૌતિક    |
| વ) જિતેન્દ્ર શિવાભાઇ સોની,<br>૨) સંપાબેન જિતેન્દ્ર સોની<br>લોન નંબર :<br>૧૭૩૬૧૦૪૦૦૦૧૭૭૦ અને<br>૧૭૩૬૨૨૬૩૦૦૦૦૩૦૦   | <u>૧૩.૧૦.૨૦૨૧</u><br>રૂા. ૧૬,૦૧,૮૭૫/–<br>(રૂપિયા સોળ લાખ<br>એક હંજાર આઠસો<br>પંચોતેર પુરા) | ફલેટ નં. ૧૪, ત્રીજો માળ, ક્ષેત્રફળ ૯૪ ચો. ચાર્ક, "દા મેઘાણી<br>ચેમ્બર્સ એસોસિચેશન" તરીકે જાણીતી સ્ક્રીમ,<br>૨૦૮/૧+૨૦૮/૨, ફાઇનલ પ્લોટ નં. ૧૪૮ અને ૧૪૯, ટીપી<br>સ્ક્રીમ નં. ૩૦, મોજે–અસારવા, તાલુકો સિટી–જિલ્લો–<br>અમદાવાદ અને રજીસ્ટ્રેશન પેટા જિલ્લો–અમદાવાદ–દ્<br>(નરોડા) ખાતેની મિલકતના તમામ ભાગમાં રસ ધરાવતા હક્ક<br>અને હિત.  | <u>૦૭.૦૮.૨૦૨૨</u><br>ભૌતિક    |
| ૧) ગણેશ અસાઇથાંભી<br>મુદલિયાર<br>૨) થેનમોઝી ગણેશ<br>મોદલિયાર<br>લોન નંબર :<br>૧૭૩૬૧૦૪૦૦૦૧૫૯૦ અને<br>૧૭૩૬૨૬૩૦૦૦૦૫૫૦   | <u>૦૯.૦૪.૨૦૨૧</u><br>રૂા. ૧૮,૦૮,૭૯૦/–<br>(રૂપિયા અઢાર લાખ<br>આઠ હજાર સાતસો<br>નેવું પુરા)  | ફલેટ નં. લ્3/હરદ્દ, ક્ષેત્રફળ ૩૭.૮૧ ચો.મી., ગુજરાત<br>લઉસિંગ બોર્ડ, "સર્વોદય કોલોની" તરીકે જાણીતી, સર્વે નં.<br>૪૫ અને ૪૬, ફાઇનલ પ્લોટ નં. ૩૨ પૈકી, ટીપી નં. ૭, સિટી સર્વે<br>નં. ૧૩૧૨, મોજે–ગામ–મીથીપુર, તાલુકો–સિટી, રજીસ્ટ્રેશન<br>જિલ્લો–અમદાવાદ–૭ (ઓઢવ) ખાતેની મિલકતના તમામ ૨સ,<br>હક્ક ધરાવતી મિલકત.   | <u>૦૯.૦૮.૨૦૨૨</u><br>ભૌતિક    |

આથી ખાસ કરીને દેવાદારો અને જાહેર જનતાને આથી જણાવેલ મિલકત સાથે કોઇ સોદો ન કરવા સાવધ કરવામાં આવે છે અને મિલકત સાથેનો કોઇપણ વ્યવહાર ફુલર્ટન ઇન્ડિયા ક્રેડિટ કંપની લીમીટેડની નીચે જણાવેલ ૨૬મ અને તેના પરના ચાર્જને આદિાન રહેશે. ર્સે ક્યોર્ડ એસેટ પરત મેળવવા માટે ઉપલબ્ધ સમયમર્યાદાના સબંધમાં એક્ટની કલમ ૧૩ ની પેટા કલમ (૮) ની જોગવાઇઓ પ્રત્યે દેવાદારોનું ધ્યાન દોરવામાં આવે છે

તારીખ : ૧૧.૦૮.૨૦૨૨ થળ : અમદાવાદ

સહી/– અદ્યિકૃત અદ્યિકારી, ફુલર્ટન ઇન્ડિયા ક્રેડિટ કંપની લીમીટેડ

# **ARDI INVESTMENT & TRADING COMPANY LIMITED**

EXTRACT OF UNAUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30TH JUNE 2022

CIN: L65923MH1981PLC024912

Address: Shop No. 3, Hemu Castle, Dada hari Road, Nr. Gokhibai School Vile Parle West, Mumbai, Maharashtra-400056. Phone: 9898614159, Email: compliancingardi@gmail.com

|            |  |  |  |  | (Rs. in Lacs                              |
|------------|--|--|--|--|---|
| Sr.<br>No. | Particulars  | Quarter<br>ended on<br>30.06.2022<br>Unaudited | Quarter<br>ended on<br>31.03.2022<br>Audited | Quarter<br>ended on<br>30.06.2021<br>Unaudited | Year<br>ended on<br>31.03.2022<br>Audited |
| 1          | Total Income   | 3.22   | -41.66                                       | 0.00   | -40.91                                    |
| 2          | Net Profit for the year before tax                                   | 2.57   | -41.67                                       | -6.01  | -51.73                                    |
| 3          | Net Profit for the year after tax                                    | 2.57   | -41.67                                       | -6.01  | -51.73                                    |
| 4          | Total Comprehensive Income for the year                              | 2.57   | -41.67                                       | -6.01  | -51.73                                    |
| 5          | Paid up Equity Share Capital   | 40.00  | 40.00  | 40.00  | 40.00                                     |
| 6          | Other Equity Excluding Revaluation Reserve                           | _  | _  | _  | _   |
| 7          | Earnings per share (Face Value of Rs. 10/- each) - Basic and Diluted | 0.64   | -10.42                                       | -1.50  | -12.93                                    |

- (1) The above Financial Results were reviewed by the Audit Committee and Approved by the Board of Directors at their respective Meetings held on 09th August, 2022
- (2) The Statutory Auditors have carried out Limited Review of the above standalone financial results for the quarter ended 30th June 2022
- as required under Regulation 33 of SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015.

  (3) The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of ents) Regulations, 2015. The full format of the same is available on the SEBI (Listing and Obligations and Disclosure Require websites of the Stock Exchange(s) and the listed entity.
- ssified where considered necessary to conform to current period's classification.

For and on behalf of Ardi Investment & Trading Company Limited S/d

Gautam P. Sheth Director (DIN: 06748854) Date: 09.08.2022

|           | DA TOLL ROAD PRIVATE LII  Regd. Office:6, Floor- 2nd, Plot no. 134, Birla Mansion, Nagindas Master Lane, Kala Gh CIN - U45203MH2010PTC203502 |  | ai- Maharashtra - 4                             | 400001                                     |
|-----------|--|--|---|--|
| ST        | ATEMENT OF FINANCIAL RESULTS FOR THE QUARTER ENDEC   | JUNE 30, 2                                     | 2 <b>022</b> (Amoun                             | t in Rs. Lacs                              |
| SI<br>No. | Particulars  | Quarter<br>ended<br>June 30, 2022<br>Unaudited | Quarter ended<br>March<br>31, 2022<br>Unaudited | Year ended<br>March<br>31, 2022<br>Audited |
| 1         | Total Income from Operations   | 12,758.64                                      | 11,712.12                                       | 54,746.92                                  |
| 2         | Net Profit / (Loss) for the period (Before Tax, Exceptional and / or Extraodinary Items)   | -987.34  | -8,065.93                                       | -30,065.53                                 |
| 3         | Net Profit/(Loss) for the period Before Tax (after Exceptional and / or Extraodinary Items)  | -987.34  | -8,065.93                                       | -30,065.53                                 |
| 4         | Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraodinary Items)   | -987.34  | -8,065.75                                       | -27,296.20                                 |
| 5         | Total Comprehensive Income for the period (Comprising profit / (Loss) for the period   | -987.66  | -8,066.25                                       | -27,297.49                                 |
|           | (after tax) and other Comprehensive Income (after tax)   |  |   |  |
| 6         | Paid-up equity share capital (Face value of Rs. 10 each)   | 901.80   | 901.80  | 901.80                                     |
| 7         | Other equity (Reserves excluding revaluation reserves)   | -  | -19,365.49                                      | -19,365.49                                 |
| 8         | Security Premium Account   | 8,107.24                                       | 8,107.24  | 8,107.24                                   |
| 9         | Net worth  | -19,451.35                                     | -18,463.69                                      | -18,463.69                                 |
| 10        | Paid up debt capital / Outstanding debt  | 292,394.32                                     | 341,169.78                                      | 341,169.78                                 |
| 11        | Outstanding Redeemable Preference Shares   | -  | -   | -  |
| 12        | Debt / Equity Ratio  | -15.03   | -18.48  | -18.48                                     |
| 13        | Earnings per share (EPS) ( Face value of Rs. 10/- each )   |  |   |  |
|           | 1. Basic   | -10.95   | -89.44  | -302.69                                    |
|           | 2. Diluted   | -10.95   | -89.44  | -302.69                                    |
| 14        | Capital Reserve  | -  | -   | -  |
| 15        | Debenture redemption reserve   | -  | -   | -  |
| 16        | Debt Service Coverage Ratio  | 1.27   | 0.39  | 0.44                                       |
| 17        | Interest Service Coverage Ratio  | 1.46   | 0.52  | 0.57                                       |

Notes:

- The above financial results for the quater ended June 30, 2022 have been reviewed and approved by the Board of Directors in their meeting held
- 2 The above is an extract of the detailed format of quarterly financial results filed with the BSE Limited (BSE) under Regulation 52 of the SEBI (Listin
- Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the quarterly financial results is available on the websites of BSE Limited (BSE) on https://www.bseindia.com/ and on the Company website: http://www.datrl.in/.

  For the items referred to in sub clause of the Regulation 52(4) of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure For the items referred to in sub clause of the Regulation 52(4) of the Securities and Exchange boatd on invita classing Congregation of the Requirements). Regulations, 2015 the pertinent disclosures have been made to the BSE Limited (BSE) and can be accessed on https://www.bseindia.com/.

  For and on behalf of the Board of Directors of DA Toll Road Private Limited.

Date: Aug 10, 2022



# એયુ સ્મોલ ફાચનાન્સ બેંક લીમીટેડ

શિક્યુલ્ડ કોમર્સિયલ બેંક

૨જીસ્ટર્ડ ઓફીસ : ૧૯−એ, દુલેશ્વર ગાર્ડન, અજમેર રોડ, જથપુર–૩૦૨૦૦૧ (CIN : L36911RJ1996PLC011381) ૨૦૦૨ ના સિક્યોરીટાઇઝેશન કાયદાની કલમ ૧૩(૨) હેઠળ માંગણાં નોટીસ

લોન એકાઉન્ટ એનપીએ થયા હોવાથી સિક્ચોરીટાઇગ્રેશન અને રીકન્સ્ટુક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટસ અને એનફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ ની કલમ ૧૩(૨) હેઠળ અધિકૃત અધિકારીએ નીચેનાં કોષ્ટકમાં આપેલ દેવાદારો/ સહ-દેવાદારો/ ગીરવેદાર/ જામીનદારો (સંયુક્ત રીતે દેવાદારો તરીકે વર્ણવેલ) ને ૬૦ દિવસીય માંગણાં નોટીસ જારી કરે છે. નોટીસ મુજબ જો દેવાદાર ૬૦ દિવસોમાં ૨કમ જમા નહી કરે તો, નીચે આપેલી ગીરો મિલકતો / સિક્ચોર્ડ એસેટની હરાજી કરીને વસુલવામાં આવશે. તમે દેવાદારોને લોનની રકમ સહીત અન્ય વ્યાજ અને વસુલાત ખર્ચ માંગણા નોટીસની તારીખથી ૬૦ દિવસમાં જમા કરાવી જવા જાણ કરવામાં આવે છે, નહીંતર જ્યાવેલ કાયદાની કલમ ૧૩(૪) અને ૧૪ હેઠળની જોગવાઇઓ હેઠળ અધિકૃત અધિકારી નીચે આપેલ ગીરો મિલકતો / સિક્ચોર્ડ એસેટોનો કબજો લેવા સ્વતંત્ર છે.

દેવાદારોએ નોંધ લેવી કે આ નોટીસની બજવણી પછી કાયદા,ર૦૦૨ની કલમ ૧૩(૧૩) અન્વયે તમને સિક્ચોર્ડ ક્રેડિટરની આગોતરી લેખીત સંમંતી વગર કોઇપણ સિક્ચોર્ડ એસેટની વેચાણ, ભાડે અથવા અન્ય રીતે ફેરબદલી કરવા મનાઇ ફરમાવવામાં આવે છે. દ્ય સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ એક્ટ ના નિયમ ૩(૫) સાથે વંચાતી કલમ ૧૩(૮) પ્રત્યે દેવાદારોનું ધ્યાન દોરવામાં આવે છે કે જાહેર નોટીસના પ્રકાશન પહેલા નીચે જણાવેલ સંપૂર્ણ બાકી લેણાંની ચુકવણી કરીને સિક્ચોર્ડ એસેટ છોડાવા દેવાદારો હકદાર બનશે, ત્યાર બાદ છુટકારોનો અંત આવશે.

| દેવાદારો/સહ–દેવાદાર/જામીનદારો/                                 | કલમ ૧૩(૨) હેઠળ માગણ    |   |
|--|------------------------|---|
| ગીરવેદારોનાં નામ/લોન એકા. નં.                                  | નોટીસની તારીખ અને રક   | મ વિગત  |
| લોન એકાઉન્ટ નં. ૧૮૨૧૨૧૨૪૧૯૮૭૭૫૮૨                               | 5/८/२०२२               | હાચપોથીકેશનની વિગતઃ                                     |
| મેસર્સ પ્રસાદ સીડ્સ ઇન્ડસ્ટ્રીઝ તેના ભાગીદાર                   | રૂા. ૩૦,૩૯,૦૫૨.૦૦      | લોન હેઠળ ધિરાણ કરાચેલ વર્તમાન અને ભાવ મિલકતો પર         |
| શ્રી દિલિપભાઇ સમજુભાઇ શેખડા મારફત,                             | (રૂપિયા ત્રીસ લાખ      | હાચપોથીકેશનના માર્ગે પ્રથમ અને એક્સક્લુઝીવ ચાર્જ.       |
| શ્રી ચંદ્રેશભાઇ સમજુભાઇ શેખડા,                                 | ઓગણચાલીસ હજાર બાવન     | ગીરો સ્થાવર મિલકતોની વિગતઃ                              |
| શ્રીમતી ગીતાબેન દિલિપભાઇ શેખડા અને                             | પુરા) ર ઓગસ્ટ, રર મુજબ | ૧.પ્લોટ નં. ૧૦/પૈકી પુર્વ બાજુની જમીન, ક્ષેત્રફળ ૯૧–૯૮૮ |
| શ્રીમતી ભાનુબેન ચંદ્રેશભાઇ શેખડા                               |                        | ચો.મી., રેવન્યુ સર્વે નં. ૧૩ અને ૧૪, કુલ જમીન ક્ષેત્રફળ |
| (દેવાદાર)  |                        | એક્ટ ૨–૨૮ જોષીપુરાના ગુઠા ધરાવતી એન.એ જમીન પર           |
| શ્રી દિલિપભાઇ સમજુભાઇ શેખડા જે શ્રી                            |                        | બંધાચેલ ઘરની જુનાગઢ મ્યુન્સિપલ કોર્પોરેશનની હદમાં,      |
| સમજુભાઇ મેપાભાઇ શેખડાના પુત્ર                                  |                        | શ્રી દિલિપભાઇ સમજુભાઇ શેખડા અને શ્રી ચંદ્રેશભાઇ         |
| (જામીનદાર/ગીરવેદાર)  |                        | સમજુભાઇ શેખડાની માલિકીની મિલકતના તમામ ભાગ               |
| શ્રી ચંદ્રેશભાઇ સમજુભાઇ શેખડા જે શ્રી<br>સમજુભાઇ મેપાભાઇ શેખડા |                        | અને હિસ્સા.   |
| (જામીનદાર/ગીરવેદાર) શ્રીમતી ગીતાબેન                            |                        |   |
| દિલિપભાઇ શેખડા જે શ્રી દિલિપભાઇ                                |                        |   |
| સમજુભાઇ શે ખડાના પત્ની (જામીનદા૨)                              |                        |   |
| શ્રીમતી ભાનુબેન સંદ્રેશભાઇ શેખડા જે શ્રી                       |                        |   |
| ચંદ્રેશભાઇ સમજુભાઇ શેખડાના પત્ની                               |                        |   |
| (જામીનદાર)   |                        |   |
| તારીખ : ૧૦.૦૮.૨૦૨૨   |                        | અધિકૃત અધિકારી  |
| સ્થળ : જુનાગઢ, ગુજરાત  |                        | એચુ સ્મોલ ફાયનાન્સ બેંક લીમીટેડ                         |
|  |                        |   |

**Panchmahal** Steel Limited

Registered Office: GIDC Industrial Estate, Kalol-389 330, Dist. Panchmahals, Gujarat CIN: L27104GJ1972PLC002153, Phone No: 02676-230777, Fax No: 02676-230889

|     |  |              |               |              | ₹ in Lac       |  |
|-----|--|--------------|---------------|--------------|----------------|--|
| Sr. |  |              | Quarter ended |              |                |  |
| No. | Particulars  | 30.06.2022   | 31.03.2022    | 30.06.2021   | 31.03.2022     |  |
|     |  | (Unaudited)  | (Audited)     | (Unaudited)  | (Audited)      |  |
| 1   | Total Income   | 13,515.08    | 14,452.81     | 9,143.67     | 57,760.94      |  |
| 2   | Net Profit / (Loss) for the period (before Tax,<br>Exceptional and/or Extraordinary items)   | 1352.16      | 1987.26       | 634.80       | 6655.06        |  |
| 3   | Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)   | 1352.16      | 1987.26       | 634.80       | 6655.06        |  |
| 4   | Net Profit / (Loss) for the period after Tax<br>(after Exceptional and/or Extraordinary items)   | 985.53       | 1480.00       | 634.80       | 5858.22        |  |
| 5   | Total Comprehensive Income for the period [comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)] | 982.52       | 1444.91       | 637.82       | 5829.91        |  |
| 6   | Equity Share Capital   | 1907.83      | 1907.83       | 1908.31      | 1907.83        |  |
| 7   | Reserves excluding Revaluation Reserve   |              | 14088         | 3.27         | •              |  |
| 8   | Earnings Per Share (of ₹ 10/- each) (for continuing and discontinued operations)   |              |               |              |                |  |
|     | a) Basic<br>b) Diluted   | 5.17<br>5.17 | 7.76<br>7.76  | 3.33<br>3.33 | 30.71<br>30.71 |  |

Place: Vadodara

Date: 10th August, 2022

The above is an extract of the detailed format of Quarterly Unaudited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Unaudited Financial Results for the first quarter ended on 30th June, 2022 are available on the website of Stock Exchange at www.bseindia.com and also on the Company's website at www.panchmahalsteel.co.in

For Panchmahal Steel Limited

Ashok Malhotra

DIN - 00120198

Chairman & Managing Director

For the Indian Intelligent. The Indian Express.

**Branch Office:** ICICI Bank Limited, Jayhind Annex, Opp. Sharda Baug Near Dharam Cinema, Rajkot-360001.

PUBLIC NOTICE - TENDER CUM E-AUCTION FOR SALE OF SECURED ASSET [See proviso to rule 8(6)]
Notice for sale of immovable assets

E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor(s) that the below described immovable property mortgaged/charged to the Secured Creditor, the physical possession of which has been taken by the Authorised Officer of ICICI Bank Limited will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" as per the brief particulars given

| N | Sr.<br>No. | Name of<br>Borrower(s)/<br>Co-Borrowers/<br>Guarantors/<br>Loan Account No.   | Details of the<br>Secured asset(s)<br>with known<br>encumbrances, if any   | Amount<br>Outstanding                               | Earnest                                     | Date and<br>Time of<br>Property<br>Inspection    | Date &<br>Time of<br>E-Auction                          |
|---|------------|---|--|---|---|--|---|
| ( | (A)        | (B)   | (C)  | (D)   | (E)   | (F)  | (G)   |
|   | 1.         | Ashishbhai Hareshbhai<br>Kareliya (Borrower)/ Dipakbhai<br>Hareshbhai Kareliya (Co-<br>Borrower) Loan A/c No.<br>LBRAJ00002387771/<br>LBRAJ00002387772/<br>LBRAJ00002909257 | Plot No: 383 Paiki Of F.P NO.148(P), City<br>Survey Ward No 8/2, Shree Narayan Nagar<br>Co.Op Housing Society Ltd, C.S No<br>2612/1, 10 Near Hanuman Temple, R.S<br>No.331,332,333, Near Radha Krushna Apt,<br>Rajkot-360001. Land area 71.97 Sq. Mtr.<br>Free Hold Property | Rs.<br>59,61,601/-<br>(As on<br>August<br>03, 2022) | Rs.40,00,<br>000/-<br>Rs.<br>4,00,<br>000/- | August<br>25, 2022<br>11:00 AM<br>To<br>01:00 PM | September<br>20, 2022<br>From<br>11:00 AM<br>Onwards    |
|   |            | Rijvana Javidbhai Kadri<br>(Borrower)/ Javedhusen<br>MukhtarAhemad Quadari (Co-<br>Borrower) Loan A/c No.<br>LBRAJ00004922015   | Row House No.2, Revenue Survey No.104,<br>Plot No.17 Paiki of Sub Plot No.17/1,<br>Gokuldham Main Road, Mouje Village-<br>Mavdi, Rajkot- 360005. Land area 57.89<br>Sq. Mtr Free Hold Property   | Rs.<br>31,25,755/-<br>(as on July<br>27, 2022)      | Rs.29,10,<br>000/-<br>Rs.<br>2,91,<br>000/- | August<br>25 2022<br>01:30 PM<br>To<br>3:00 PM   | September<br>20, 2022<br>From<br>12:00 Noon<br>Onwardss |

The online auction will be conducted on website (URL Link- https://disposalhub.com) of our E-auction agency M/s NexXen Solutions Private Limited. The Mortgagors/ noticee are given a last chance to pay the total dues with further interest till September 19, 2022 before 04:00 PM else these secured assets will be sold as per schedule.

The Prospective Bidder(s) must submit the Earnest Money Deposit (EMD) Demand Draft (DD) (Refer Column E) at ICICI Bank Limited, Jayhind Annex, Opp. Sharda Baug, Near Dharam Cinema, Rajkot-360001 or before September 19, 2022 before 03:00 PM and thereafter they need to submit their offer through the above mentioned website only on or before September 19, 2022 before 04:00 PM along with scan image of Bank acknowledged DD towards proof of payment of EMD. Kindly note, in case prospective bidder(s) are unable to submit their offer through the website then signed copy of tender documents may be submitted at ICICI Bank Limited, Jayhind Annex, Opp. Sharda Baug, Near Dharam Cinema, Rajkot-360001 on or before September 19, 2022 before 05:00 PM Earnest Money Deposit DD/PO should be from a Nationalised/Scheduled Bank in favour of "ICICI Bank Limited" payable at Rajkot at Rajkot.

For any further clarifications with regards to inspection, terms and conditions of the E-auction or submission of tenders, kindly contact ICICI Bank Limited on 7573024297.

Please note that Marketing agencies 1. M/s NexXen Solutions Private Limited 2. Augeo Asset Management Private Limited have also been engaged for facilitating the sale of this property.

The Authorised Officer reserves the right to reject any or all the bids without furnishing any further reasons.

For detailed terms and conditions of the sale, please visit www.icicibank.com/n4p4s

Date: August 10, 2022 Place: Rajkot

Authorized Officer ICICI Bank Limited



Place : Ahmedabad Date : 10-08-2022

## ADINATH EXIM RESOURCES LIMITED

CIN: L65100GJ1995PLC024300

601, Astron Tower, Opp. Iskon Mandir, Nr. Casalla Tower, Satellite, Ahmedabad-380015, Gujarat Ph. 6351738619 E-mail: aerlnodalofficer@gmail.com Website: www.adinatheximresources.com

EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON JUNE 30, 2022 (Rs. In Lacs except EPS)

|      |  |             |            | lalone      |            |
|------|--|-------------|------------|-------------|------------|
| Sr   | Particulars Particulars  | Quarte      | r Ended    | Year E      | Ended      |
| No   | Particulars  | 30.06.2022  | 31.03.2022 | 30.06.2021  | 31.03.2022 |
|      |  | (Unaudited) | (Audited)  | (Unaudited) | (Audited)  |
| 1    | Total Income from Operation(Net)   | 23.58       | 24.82      | 23.83       | 97.48      |
| 2    | Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)      | 15.90       | 17.90      | 20.85       | 75.46      |
| 3    | Profit / (Loss) for the period after Exceptional (before tax and Extraordinary items)    | 15.90       | 17.90      | 20.85       | 75.46      |
| 4    | Profit / (Loss) for the period after Exceptional and/or Extraordinary items (before tax) | 15.90       | 17.90      | 20.85       | 75.46      |
| 5    | Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]   | 5.97        | -8.19      | 14.35       | 34.93      |
| 6    | Equity Share Capital   | 431.91      | 431.91     | 431.91      | 431.91     |
| 7    | Other Equity   | 0.00        | 00.00      | 00.00       | 1149.54    |
| 8    | Earning Per Share (Face Value of ₹10/- each)   |             |            |             |            |
|      | Basic & Diluted  | 0.14        | -0.19      | 0.33        | 0.81       |
| Note | 8.   |             |            |             |            |

(1) The above is an extract of the detailed format of unaudited Financial Results for the Quarter ended on June 30, 2022 filled with Stock Exchange under Regulation 33 of SEBI (Listing Obligation and Disclosures Requirements) Regulations, 2015. The full format of unaudited financial results of the Company for the Quarter ended

on June 30, 2022 are available on the Company's website www.adinatheximresources.com and website of the Stock Exchange www.bseindia.com (2) The above results were reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on August 10, 2022.

For, ADINATH EXIM RESOURCES LIMITED Manoj S. Savla

Managing Director

(DIN: 01529306)



Place: Bil

Date: 10.08.2022

# **BANCO PRODUCTS (INDIA) LIMITED**

Regd. Office: Bil, Near Bhaili Rly. Station, Padra Road, Dist. Vadodara - 391 410. Tel. No.: (0265) 2318226, FAX: - 2680433 CIN NO:- L51100GJ1961PLC001039, Website:- www.bancoindia.com, E-mail:- investor@bancoindia.com

## **EXTRACT OF STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30TH JUNE 2022**

|   |   | Stand                                       | lalone  |  |   | Conso                                       | lidated                                       |   |
|---|---|---|---|--|---|---|---|---|
| Particulars   | Quarter<br>ended<br>30.06.2022<br>(Unaudited) | Quarter<br>ended<br>31.03.2022<br>(Audited) | Quarter<br>ended<br>30.06.2021<br>(Unaudited) | Year<br>ended<br>31.03.2022<br>(Audited) | Quarter<br>ended<br>30.06.2022<br>(Unaudited) | Quarter<br>ended<br>31.03.2022<br>(Audited) | Quarter<br>ended<br>30.06.2021<br>(Unaudited) | Year<br>ended<br>31.03.202<br>(Audited) |
| Total income from Operations  | 25,415  | 22,958                                      | 17,359  | 82,442                                   | 58,682  | 50,597                                      | 50,793  | 196,300                                 |
| Net profit /(loss) for the period ( before tax, exceptional and/or extra ordinary items)  | 4,130   | 2,722                                       | 2,213   | 11,000                                   | 5,463   | 5,251                                       | 7,119   | 22,376                                  |
| Net profit /(loss) for the period before tax (after exceptional and/or extra ordinary items)  | 4,130   | 2,722                                       | 2,213   | 11,000                                   | 5,463   | 5,251                                       | 7,119   | 22,376                                  |
| Net profit /(loss) for the period after tax (after exceptional and/or extra ordinary items)   | 3,376   | 1,910                                       | 1,675   | 8,566                                    | 3,459   | 4,019                                       | 4,590   | 15,242                                  |
| Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax) | 3,376   | 1,909                                       | 1,675   | 8,454                                    | 3,859   | 4,375                                       | 6,152   | 16,760                                  |
| Equity Share Capital  | 1,430   | 1,430                                       | 1,430   | 1,430                                    | 1,430   | 1,430                                       | 1,430   | 1,430                                   |
| Reserves (excluding Revaluation Reserve as shown in the Audited Balance Sheet of previous year)   | Rs.6  | 7,059/-Lakhs a                              | s on 31st March                               | 2022                                     | Rs.96   | 6,687/-Lakhs as                             | s on 31st March                               | 2022                                    |
| Earning per share (of Rs. 2 /- each) ( for continuing and discontinued operations)  |   |   |   |  |   |   |   |   |
| Basic   | 4.72  | 2.67  | 2.34  | 11.98                                    | 4.84  | 5.62  | 6.42  | 21.31                                   |
| Diluted   | 4.72  | 2.67  | 2.34  | 11.98                                    | 4.84  | 5.62  | 6.42  | 21.31                                   |

Note: (1) The above is an extract of the detailed format of the Unaudited Financial Results of the Company for the Quarter ended 30th June, 2022 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarter ended on 30th June, 2022 are available on the website of BSE Limited at www.bseindia.com, National Stock Exchange of India Limited at www.nseindia.com and on the website of the Company at www.bancoindia.com. (2) The above results (Standalone and Consolidated) have been prepared in accordance with Indian Accounting Standards ('IND AS) notified under section 133 of the companies Act 2013, read together with relevant rules issued there under and other accounting principles generally accepted in India

> For Banco Products (India) Limited (Mehul K Patel) Chairman



Registered Office: GIDC Industrial Estate, Kalol-389 330, Dist. Panchmahals, Gujarat CIN: L27104GJ1972PLC002153, Phone No: 02676-230777, Fax No: 02676-230889 Email: shares@panchmahalsteel.co.in Website: www.panchmahalsteel.co.in

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30™ JUNE, 2022

| Sr. |  | (           | Quarter endec | I           | Year ended |
|-----|--|-------------|---------------|-------------|------------|
| No. | Particulars  | 30.06.2022  | 31.03.2022    | 30.06.2021  | 31.03.2022 |
|     |  | (Unaudited) | (Audited)     | (Unaudited) | (Audited)  |
| 1   | Total Income   | 13,515.08   | 14,452.81     | 9,143.67    | 57,760.94  |
| 2   | Net Profit / (Loss) for the period (before Tax,<br>Exceptional and/or Extraordinary items)   | 1352.16     | 1987.26       | 634.80      | 6655.06    |
| 3   | Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)   | 1352.16     | 1987.26       | 634.80      | 6655.06    |
| 4   | Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)  | 985.53      | 1480.00       | 634.80      | 5858.22    |
| 5   | Total Comprehensive Income for the period [comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)] | 982.52      | 1444.91       | 637.82      | 5829.91    |
| 6   | Equity Share Capital   | 1907.83     | 1907.83       | 1908.31     | 1907.83    |
| 7   | Reserves excluding Revaluation Reserve   |             | 14088         | 3.27        | •          |
| 8   | Earnings Per Share (of ₹10/- each) (for continuing and discontinued operations)  | 5.17        | 7.76          | 3.33        | 30.71      |
|     | a) Basic<br>b) Diluted   | 5.17        | 7.76          | 3.33        | 30.71      |

Place: Vadodara

Date: 10th August, 2022

The above is an extract of the detailed format of Quarterly Unaudited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Unaudited Financial Results for the first quarter ended on 30th June, 2022 are available on the website of Stock Exchange at www.bseindia.com and also on the Company's website at www.panchmahalsteel.co.in

For Panchmahal Steel Limited

Ashok Malhotra Chairman & Managing Director DIN - 00120198



# **HLE Glascoat Limited**

CIN: L26100GJ1991PLC016173 | GSTIN: 24AACCS6297G1Z5

# Extract of Statement of Un-Audited Financial Results for the Quarter ended on 30th June, 2022

|     |  |                  | Standa           | alone            |                  |                  | Consc            | olidated         | except EPS)      |
|-----|--|------------------|------------------|------------------|------------------|------------------|------------------|------------------|------------------|
| Sr. | Particulars  | Q                | uarter Ended     |                  | Year Ended       | (                | uarter Ende      | ed               | Year Ended       |
| No. | Tarticulars  | 30.06.22         | 31.03.22         | 30.06.21         | 31.03.22         | 30.06.22         | 31.03.22         | 30.06.21         | 31.03.22         |
|     |  | UNAUDITED        | AUDITED          | UNAUDITED        | AUDITED          | UNAUDITED        | AUDITED          | UNAUDITED        | AUDITED          |
| 1   | Total Income from Operation (net)  | 14086.31         | 15759.30         | 11234.16         | 50848.93         | 20442.35         | 24922.79         | 12423.52         | 65221.82         |
| 2   | Net Profit/ (Loss) for the period (before<br>Tax, Exceptional and / or Extraordinary<br>items*)  | 1766.14          | 2026.91          | 1983.41          | 8096.85          | 2181.76          | 3052.17          | 2046.99          | 9342.70          |
| 3   | Net Profit/ (Loss) for the period before<br>Tax, (after Exceptional and / or<br>Extraordinary items*)                                    | 1766.14          | 2026.91          | 1983.41          | 8096.85          | 2181.76          | 2981.92          | 2046.99          | 8431.28          |
| 4   | Net Profit/ (Loss) for the period after Tax,<br>(after Exceptional and / or Extraordinary<br>items*)                                     | 1302.22          | 1763.23          | 1419.88          | 6176.48          | 1537.81          | 2332.92          | 1419.35          | 5823.34          |
| 5   | Total Comprehensive Income for the period [Comprising Profit / (loss) for period (after tax) and Other Comprehensive Income (after tax)] | 1298.36          | 1831.60          | 1409.96          | 6215.08          | 1533.95          | 2494.49          | 1409.43          | 5955.14          |
| 6   | Equity Share Capital   | 1365.31          | 1365.31          | 1346.06          | 1365.31          | 1365.31          | 1365.31          | 1346.06          | 1365.31          |
| 7   | Reserves (excluding Revaluation Reserve)<br>as shown in the Audited Balance Sheet of<br>the previous year.                               | -                | 94               | -                |                  |                  |                  |                  |                  |
|     | Earning Per Share (of Rs 10/- each) a.(from continuing operations)   |                  |                  |                  |                  |                  |                  |                  |                  |
| 8   | Basic<br>Diluted   | 9.99<br>9.99     | 13.78<br>13.78   | 11.11<br>11.09   | 47.02<br>47.02   | 11.72<br>11.72   | 17.96<br>17.96   |                  | 44.44<br>11.11   |
|     | b.(from discontinuing operations)  Basic  Diluted  | (0.45)<br>(0.45) | (0.87)<br>(0.87) | (0.44)<br>(0.44) | (1.79)<br>(1.79) | (0.45)<br>(0.45) | (0.87)<br>(0.87) | (0.44)<br>(0.44) | (1.79)<br>(1.79) |

The above is an extract of the detailed format of Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure

Requirements) Regulations, 2015. The full format of the quarterly financial results are available on the websites of the Stock Exchange(s): www.bseindia.com and the

The Board of Directors has resolved for the closure and winding down of the Chemical Business operations. The performance of the discontinuing operations included in the above results for the quarter ended 30th June, 2022 are as follows:

Revenue - Rs. 198.06 lakhs, Expenses - Rs. 259.74 lakhs, Loss - Rs. 61.68 lakhs, Assets - Rs. 2251.97 lakhs, Liabilities - Rs. 273.88 lakhs.

The Company completed the acquisition of 100% shareholding in Thaletec GmbH, Germany on 17th December, 2021. The financial information for the respective periods include the performance of Thaletec GmbH and its wholly owned subsidiary Thaletec Inc., USA for the period commencing from the date of acquisition.

> For HLE Glascoat Limited Sd/-Himanshu Patel

**Managing Director** 

# I SECURE CREDIT & CAPITAL SERVICES LIMITED

(FORMERLY KNOWN AS ORCHID SECURITIES LIMITED) CIN: L18209WB1994PLC062173 Regd. Office: MMS Chambers, 4A, Council House Street, 1st Floor, Room No. D1, Kolkata - 700001

Admin. Office: 1st Floor, Hall No. 2, MR Icon, Next to Milestone Residency,

Bhayli, Vadodara - 39141

Corp. Office: 1st Floor, City Castle Building East Fort, Thrissur-680005, Kerala E-mail: compliance@iccslimited.in
Website: www.orchidsecuritiesltd.com | Tel No.: +917574895589

| Extract of Standalone Audited Financial Result for the quarter ended 30th June, 2022 (₹. in Lakhs) |   |   |   |   |  |  |  |  |
|--|---|---|---|---|--|--|--|--|
|  |   |   | Stand   | alone   |  |  |  |  |
| SI.<br>No.   | Particulars   | Quarter<br>Ended<br>30-06-2022<br>(Unaudited) | Quarter ended<br>31-03-2022<br>(Audited)<br>(Refer Note No 3) | Quarter<br>Ended<br>30-06-2021<br>(Unaudited) | Year<br>Ended<br>31-03-2022<br>(Audited) |  |  |  |
| 1 2  | Total Income from operations Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and /or Extraordinary items#)                    | 16.91<br>(3.31)                               | 250.66<br>213.66  | 8.92<br>(4.32)                                | 389.50<br>261.39                         |  |  |  |
| 3  | Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items#)   | (3.31)  | 213.66  | (4.32)  | 261.39                                   |  |  |  |
| 4  | Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items#)  | (3.31)  | 157.93  | (4.32)  | 205.66                                   |  |  |  |
| 5  | Total Comprehensive Income for the period (Comprising profit/(loss) for the period (after tax) and other Comprehensive Income (after tax) | (3.31)  | 157.93  | (4.32)  | 205.66                                   |  |  |  |
| 6  | Paid up Equity Share Capital (No. of Shares)  | 110.001                                       | 110.001   | 30.001  | 110.001                                  |  |  |  |
| 7<br>8   | Face Value (In ₹) Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of previous year)                        | 10.00   | 10.00<br>15.70  | 10.00   | 10.00<br>15.70                           |  |  |  |
| 9  | Earnings Per Share (of ₹10/- each) (for continuing and discontinued operations)- Basic : (* Not annualised) Diluted : (* Not annualised)  | (0.03)<br>(0.03)                              | 2.91<br>2.91  | (0.14)<br>(0.14)                              | 3.79<br>3.79                             |  |  |  |

 The Statement of Unaudited Financial Result for the Quarter Ended 30th June, 2022 have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at thei 10th August, 2022.

 These Financial Results have been prepared in accordance with the Indian Accounting Standard (Ind-AS) prescribed under Section 133 of the Company Act, 2013, read together with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (as amended) and requirement of Regulation 33 of the Securities and Exchange Board of India (SEBI) (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended.

3. The Figure of the three months ended 31/03/2022 are arrived at as difference between audited figures in respect of full Financial year and unaudited published figures up to nine months of the

relevant financial vear. 4. The Statutory Auditors of the Company have carried out a "Limited Review Report" of the above results as per Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirement) Regulations, 2015. There are no qualifications in the audit report.

The previous period figures have been regrouped / reclassified wherever necessary to correspond with those the current period's classification.

6. No Investors complaint remains pending at the quarter ended on 30th June, 2022. 7. Based on the guiding principles given in Ind AS-108 on 'Operating Segments', the Company's business activity fall within a single operating segment, Namely Finance & related activities. Accordingly, the disclosure requirements of Ind AS 108 are not applicable.

B. Provision for Deferred Tax Liability, if any will be considered half yearly

9. During the Financial Year 21-22, 80,00,000 Nos. of equity warrant converted into Equity Share Capital, Face value of ₹10 each. The total amount raised was ₹8.00.00.000/- out of which 25% of the amount i.e. ₹2.00.00.000/

as been received and utilized by the Company in the F.Y. 2020-21 balance 75% of the amount i.e ₹6.00.00.000/- has been received by the Company towards convertible warrants on preferentia basis in FY. 2021-22

| Item Head  | Amount of<br>Preferential<br>Allotment<br>(in ₹) | Amount<br>Utilised up to<br>31.03.2022<br>(In ₹) | Amount<br>utilised in 1st<br>quarter of F.Y<br>22-23 (in ₹) |                |
|--|--|--|---|----------------|
| ILEITTEAU  | (111 🔨)  | (111.5)  | 22-23 (III <b>X</b> )                                       | (1113)         |
| Micro Financing, working capital requirement, general corporate purpose and temporary lending of loans and advances. | 6,00,00,000.00                                   | 2,56,67,328.00                                   | 98,23,728.00  | 2,45,08,944.00 |

10. The above Financial Results are also available on the Company's website http://www.orchidsecuritiesltd.com/and/MSEI's/website/www.msei.in

For and on behalf of the Boar

For I Secure Credit & Capital Services Limited
(Formerly known as Orchid Securities Limited

Soian Vettukallel Aviracha

(Managing Director DIN: 0759379



Date: 10th August, 2022

Place: Maroli

















OKSATTA JANSATTA (Thu, 11 August 2022)

CMD : Sanjay Shah

Phone: 0265 2787181 • Fax: 0265 2791781



# નર્મદા-ભરૂચ-અર્થકારણ

ગુરુવાર 09



# અંકલેશ્વર ભાગ્યોદય ફાયરિંગ કેસમાં ઈજાગ્રસ્ત ભરૂચજિલ્લામા આજે શ્રધ્ધાભેર મુસા વાડીવાલાનું ૬ દિવસની સારવાર બાદ મોત

અંકલેશર, તા. 10 અંકલેશર ભાગ્યોદય કાયરિંગ કેમમાં ઈક્ષાગ્રસ્ત સદાક્ત અહમદ કર્ક મુસા વાદ્યાના નું દિવસની, મારવાર બાદ મોત નીપજુર્યું હતા પાંચીસ હતા નું કહ્યમ નો ઉમારે કરી એક આરોપીની પરપદક કરી હતી. પત્નીએ અઝહર રિયાઝ ઉઠેં ભગ્યાન યોખ પટ કંકા સેવી હતી ને અઝહર દિપાલ ઉઠેં ભગ્યાન યોખ પટ કંકા સેવી હતી.



વિસ્તારના ચીકુવાડી - ભાગ્યોદય રોડ પર અલનૂર કોમ્પલેક્ષ ભાગ્યોદય રાખ પટ શકા વધા ધાતા ને ગડેલ્ડ પડ અંભાજુંટ કાન્યલલ માતા મહામદ તથા અલ નુદ કોમ્પલેલના બિલ્ડર પૈરપકડ કરી સથન તપાસ શરૂ કરી છે મુસા સઈદ અહમદ વાડીવાલા , અઝહર રિયાઝ ઉર્કે ભગવાન અને હતી.પાસ પોલીસ સુરીય માહિતી પોતાની જ્યુપિટર ગાડી લઈ ઘરે મહંમદ દ્વારી ઉર્કે કાનાની ગુલામ અનુસાર તાડીબ ગજી અંગસ્ટ આવી રહ્યા હતા દરમિયાન ગ અલી શેમ કાયરિંગ ફું હોવાની ને મોડી રાત્રીના ખંકલેશ્વર શહેર જેટલા અજાણ્યા ઈસમોએ તેમના શંકા વ્યક્ત કરી હતી. જે આપરે

હાત્યુટન પાત સારવાર ચય ખસેડવામાં આવ્યા હતા. ઈજીગ્રસ્ત ની પત્તી અકસાનાબેનની કરિયાદ નોંધાતા તેઓ ઢારા તેના પતિ પર સલીય ઉર્ફે લોટા ઉસ્માન્ શહ

સંઘેવાયેલા અને મૃતકની પત્ની દારા જેના પર શંકા સેવી હતી તે અઝહર રિયાઝ ઇર્ફે ભગવાન શેખ ની પોલીસે વિધિવત ધરપકડ કરી હતી અને તેની

# રક્ષાંબંધન પર્વની ઉજવણી કરાશે

આતુરતાથી રાહ જોતા હોય છે. નવા કપડાં પહેરી નાના ભૂલકાઓ પણ જુદા જુદા કાર્ડૂન, મ્યુઝિક-લાઈટ કે અરનવી ડિઝાઇનવારી રાખડી બાંધવા આવશે તેમ નાની નાની બહેનોની શહ જોતા

વામાન પુપામાં હવે છે. બહેન ઘરમાં પ્રવેશતાં જ માં ક્ષાલય હવે પુપામના દિવસે બહેનો બાપ, ભાઈ, ભાગી આવદાર આપી સાધ્ય જ ધોતાના બાદીઓને એકબીજને ભેટી પડે છે, ફુંડીબી હોય દેખાડી આપના હોંગ્રે કે મોસાર પલ કે પછી માનીની મહેન છે. પરંકિત બહેનો તેહી સલસ્થી ત્યાં બાઈઓને કપારે કે કું નિલ્લ જ પતિને લઈ મોટરવાતાનો લઈ કરી મોઢું મીઠું કરાવી રાખકી બાંધે કે પત્રિક ટ્રાન્સપોર્ટ બસ, ટ્રેનમાં છે. ત્યારે લાથમાં બંધાયેલ બહેનાના ક્રિલોમીટરો સુધીની પુસાક મી બીડી રક્ષા કવચ સાધ્યે બાઈ જીવનબર્સ દરમપોર્ટ બસ, રસાધ્યું ત્યાર અખતાના હોં છે. ત્યારે લાથમાં બંધાયેલ બહેનાના ક્રિલોમીટરો સુધીની પુસાક મી બીડી રક્ષા કવચ સાધ્યે બાઈ જીવનબર્સ દરમપાં બાઈ જીવનબર્સ હિલ્લ પ્રમાન સહિત્ય ધર્મની અને છે. ત્યારે બીજી તરફ બાઈઓ બિલ્લેનો બાઈઓને રાખકી બોધી પાયલ બહેનો, બાલજ અને જાઈની વિવા સ્થાલોમાનો હતેવાર ઉજવે આત્રવાથી લાહે જોતા હોંય છે. ત્યારે હી છે. ત્યારે લે બીલનો કરોના પ્રાંથક હોં સાંચે હોંય છે. છે. ત્યારે બે વર્ષના કોરોના ગ્રહણ બાદ સ્ક્ષાબંધનના અગાઉના દિવસે બજારમાં જોવા મળતી અવનવી રાખડીઓ ખરદીવા બહેનો દોડી

#### rter ended 30.06.202 Current Year To Date Corres arter ending Figures exorth prevous ye 30-JUN-21 30-UN-22 31-MAR 22 Total income from Operations "Net Profit / Loss) for the period (before Tax, Exceptional and/or Excapatinary itemsat/) Net Perdit / (Loss) for the period before tax (after Exceptional item and/or Extraordinary itemsat/) Net Profit / (Loss) for the period tax (after Exceptional and/or Extraordinary itemsat/) 3401.52 1001432 2008.6 0.81 13954 79.1 0.81 0.79 13755 62.8 Extraordinary items#) Total Comprehensive Income for the 62.8 imprehensive Income (after tax) judy Share Captel eserves (excluding Revaluation 1490.49 1490.4 Reserve) as shown in the Audited 4983.06 498306 -4983.0 samos Sheet of the previous year amings Per Share (of Rs. 1)- eac or continuing and discontinued

BARODA EXTRUSION LTD.

IG: ARASMAL KANUGO MANAGING DIRECTOR

# અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસેથી જીયોરપાટી પાસે વ્યક્તિ પર હુમલો કરનાર ૭૬ કિલો ગાંજા સાથે ચાર ઝડપાયા એસ.આર.પીજવાનને ૭વર્ષની કેદની સજા



અંકલેથર,તા.૧૦ અંકલેથરની વાલિયા યોકડી વિસ્તાર માંથી ભરૂચ એસઓજી અને જીઆઇડીસી પોલીસે ટ્રાવેલ લેગમાં લઇ જુવાતા રૂપિયા ૭.૬૩ લાખના ૩૬ કિલો ૩૦૦ ગ્રામ ગાંજાના જથ્થા

મારૂ જુનું નામ ઇમરાનભાઇ ચાકુબભાઇ પટેલ હતું બદલીને નવું નામ ઇમરાન ચાકુબભાઇ પટેલ રાખેલ છે.

તાંદલજા, વકોદરા

भाइ पुलु लाभ

રાખેલ છે. તળલ છે. ૮૯/૯૯૬, પાર્થ ભૂમિ–૨, મકરપુરા, વલેદરા.

મારૂ જુનું નામ અમરિષકુમાર ભીખાભાઇ ઘોબી હતુ બદલીને નવુ નામ બ્રમરિષકુમાર ભીખાબાઇ ચૌઠાછા રાખેલ છે. ૮૯/૯૯૬, પાર્થ ભૂમિ–૨, મુક્સ્ટાય લહેદરા

મકરપુરા, વકોદરા મારૂ જુનુ નામ પઠાણ ચારમીન રીઝવાન હતુ બદલીને નવુ નામ પઠાણ ચારિમન્ રીઝવાન

એવએલ-૧૦૨. વ્હાઇટ કાઉસ

લત્તાબદેન રમણભાઇ ધોબી . હતુ બદલીને નવુ નામ !ત્તાબેન અમરિષભાઇ ચૌહાઇ

Ajwa Fun World & Resort Limited CIN : 1452E1GJ1992PLC018294 Regd. Office : Ajwa-Nineta Road, P.O.: Ajwa Co

PARTICULARS

Changes in inventiories of work-r-grognes are soon Employee benefits expens

પ્રસાહ મનોલ પાડ, હવાર રસા માહું મનોલ ચાંદ ભગવાન ચાંદ અને રાકેશ પ્રધાન ચદાઘરપ્રધાન હોવાનું જણાવ્યું હતું પોલીસે ચારેયની ધરપકડ કરી રૂપિયા ૭.૬ રહાખ ની કિંમતનો ૭૬ કિલો ૩૦૦ ગ્રામ જીઆઇડીસી પોલીસ અને ભરૂચ ની કિંમતનો ૩ન કિંગો ૩૦૦ ગ્રામ એસઓજી પોલીસે સંયુક્ત તપાસ ગાંજનો જજાં, નજ નેગ મોલાઇક કરતા ચાર રાખ્યોને ઝડપી લીધા હતા. અને ચાર ટ્રાવેલિંગ બેંગો મળી પોલીસે ચોરેયની ટ્રાલેલ બેંગમાં તપાસ કુલ ૭.૬૮ લામ નો મુદ્દા માલ કરતા તે માંથી ગાંજનો જજાં મળી કબ્જે કરી ગુન્હો નીધી વધુ તપાસ આજ્ઞો હતો,પોલીસે ચારેય શખ્સોની હાથ ધરી હતી.

UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30TH JUNE 2022

પૂછપરછ કરતા તેઓ ઓરિસ્સાના પ્રસાદ પ્રમોદ પાંડા, દિનેશ રમેશ

3.19 0.70 3.89

9.58 2.32 6.80 9.00 29.81 (25.72)

639 m 639 m

રાજપીપપા,તા ૧૦ બુધીયો અંબાલાલ બારીયા પાસે તથા નર્મદાન જીલ્લાના મેશન્સ કોર્ટમાં તેની માતા પર્મિકાલોન પાસે મરતાં આજે ચાલી ગયેલા જીલ્લેલ હુંમલાના કેસમાં ગીલીશભાઈ ઉર્કે ભુષીયો બના લેવા માટે બોરી ચઢામાંલી કરે આંબાલાલ બારીય રહેમાં સ્થિત મુક્કે છે તેવા વેલામ ગામી માન્સરેખામાં કે આ પ્રદેશના (દેવનસી હકીકત મુજબ સુરેશભાઈ કાંત્રીબાઈ બારીયના લઈને પોતાના માટે કેશની પાયે જતા પિતાજીની મોરીયા ગામે વડીશે પાર્જન હતાં તે વખતે વિરોશ ભારીયાએ છે.એ પિલક્તમાં સુરેશભાઈએ તેવના પિતાજાની માગાના પાછળાના માગે પિતાના ભાગની મોગાશ્રો ગીરીશ ઉર્કે લીખેડનો શર્દિયા માટે કરશે મારી લાખેડનો શાઈમાં કરશે મારી

રોડ ઉપર પાડી દીધા હતા, પથ્થર વર્ડ માધામાં બે વાર મારી જીવલેલ ઈજીએ કરી તેમજ ગુણ દબાવી જાનથી મારી નાંખવાની કોશિય પણ કર્ય હતી.ભાવસંગભાઈનાં પક્ષ તરકથી સરકારી વકીલ જે જે, ગોહીલની તમામ દબીલોને પ્લાને વાઈ એસ આ ગાડી જવાન વિરીલ ભારીયાને કોર્કે હતાં તે વખતે ગિરીશ બારીયાએ ક્લમ ૩૦૭ માં ૭ વર્ષાની કેદની સજ પોતાની બાઈક ઉપર સાવી ભાવસંગ તથા પહજાર રૂપિયા દંગ્તા તથા કલમ ભાઈને માશાના પાછળના ભાગે પાઇજામે વધેની સજ તથા રહજાર હોખંડની શાઈયનો કટકો મારી રૂપિયાના દંડનો હુકમ કર્યો છે.

MUNJAL AUTO
INDUSTRIES LIMITED

Regd. Office: 187, GIDC Industrial Estate, Waghodia - 391 760, Dist: Vadodara. Tel. No. (02668) 262421-22 CIN NO. L34100GJ1985PLC007958, www.murialauto.com, E Mail: cs@munialauto.com, Fax No. (02668) 262427

#### Extract of Unaudited Financial Results for the quarter ended June 30, 2022 CONSOLIDATED **Particulars** Total income from operations Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordnary items) Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items) Net Profit (Loss) for the period after tax (efter Exceptional and/or Extraordinary items) Total Comprehensive income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive income (after tax) Equity Share Capital (Face Value of Rs. 2/- each) Reserves (excluding Revaluation Reserve) as shown in the Balance sheet of previous year Earnings Per Share (before extraordinary items) (FV of Rs. 2/- each) (Basic/Olluted EPS) Audited Una Audited 41,224.08 1,71,569.5 48,438.65 43,696.74 1,92,113.21 1,162.04 217.60 3.004.2 1,113.21 688.67 4,066.83 217.60 3,004.21 5,831.23 688.67 4,066.83 5,880.06 163.51 4,579.14 2.080.5 4,535.74 590.43 2,961.20 4.583.32 178.41 2.097.23 4,552.39 615.34 2.978.22 2,000 2,000 2,000 2,000 2,000 2,000 4.58 4.54 0.59 2.96

By order of the Board of Directors For MUNJAL AUTO INDUSTRIES LIMITED

SUDHIR KUMAR MUNJAL CHARMAN & MANAGING DIRECTOR

(DIN: 00

# Panchmahal

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE DUARTER ENDED 30" JUNE, 2022

|            |   |              |               |             | ₹in Lacs  |
|------------|---|--------------|---------------|-------------|---|
| SX.<br>No. |   | 3            | Quarter ender | 1           | Year ended  |
| No.        | Particulars   | 30.06.2922   | 31.03.2022    | 38.05.2021  | Year ended<br>31.03.2022<br>(Audited)<br>57,760.94<br>8855.06<br>6655.06<br>5858.22<br>5829.91<br>1907.83 |
|            |   | (Uxaudited)  | (Asditef)     | (Unaudited) | (Audited)   |
| 1          | Total income  | 13,515.08    | 14,452.81     | 9,143.67    | 57,780.94   |
| 2          | Net Profit / (Loss) for the period (before Tax,<br>Exceptional and/or Extraordinary items)  | 135216       | 1987.26       | 63.4.80     | 6655.06   |
| 3          | Net Profit / (Loss) for the period before Tax<br>(after Exceptional and/or Extraordinary items)   | 1352.16      | 1987.26       | 634.80      | 6655.06   |
| 4          | Net Profit / (Loss) for the period after Tax<br>(after Exceptional and/or Extraordinary items)  | 985.53       | 1480.00       | 634.80      | 5858.22   |
| 5          | Total Comprehensive income for the period<br>(comprehensive income for the period (after tax)<br>and Other Comprehensive income (after tax) | 98252        | 1444.91       | 637.82      | 5829.91   |
| 6          | Equity Share Capital  | 1907.83      | 1907.83       | 1988.31     | 1937,83   |
| 7          | Reserves excluding Revaluation Reserve  |              | 14088         | 327         |   |
| 8          | Earnings Per Sture (of ₹ 16/- each) (for continuing and discontinued operations) a) Basic b) Disard   | 5.17<br>5.17 | 7.76<br>7.76  | 3.33        | 30.71   |

Note: The above is an extract of the detailed format of Quarterly Unaudited Financial Results filed with the Exchanges under Regulation 33 of the SEM (Listing Obligations & Disclosure Requirements) Reput 2015. The fall format of the Quarterly Hunostider Financial Results for the first quarter ended or 30 2022 are available on the website of Stock Exchange at <u>www.besindis.com</u> and also on the Con For Panchmatal Steel Limit

Ashok Ma

## BANCO

Date: August 10, 2022 Place: Gurugram

# BANCO PRODUCTS (INDIA) LIMITED

Regd. Office: Bil, Near Bhaill Rly. Station, Padra Road. Dist. Vadodara - 391. 410. Tel. No.: (0265): 2318226. FAX: - 2680433 CIN NO:- L51100G1961PLC001039, Website: www.bancoindia.com, E-mail:- investor@bancoindia.com

EXTRACT OF STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30TH JUNE 2022

|  |   | Stane                                       | lalone  |  | Ü   | Consc                                       | didated                                       |  |
|--|---|---|---|--|---|---|---|--|
| Particulars  | Quarter<br>ended<br>30.06.2022<br>(Unaudited) | Guarter<br>ended<br>31.03.2022<br>(Audited) | Quarter<br>ended<br>30.06.2021<br>(Unaudited) | Year<br>ended<br>31.93.2922<br>(Audited) | Quarter<br>ended<br>39,06,2022<br>(Unaudited) | Quarter<br>ended<br>31.03.2022<br>(Audited) | Quarter<br>ended<br>30.06.2021<br>(Unaudited) | Year<br>ended<br>31,03,2022<br>(Audited) |
| Total income from Operations   | 25,415  | 22,958                                      | 17,359  | 82,442                                   | 58,582  | 50,597                                      | 50,793  | 196.300                                  |
| Net profit (loss) for the period ( before tax, exceptional and/or extra ordinary items)  | 4,130   | 2,722                                       | 2213  | 11,000                                   | 5,463   | 5,251                                       | 7,119   | 22.376                                   |
| Net profit (lioss) for the period before tax<br>(after exceptional and/or extra ordinary items)  | 4,130   | 2,722                                       | 2213  | 11,000                                   | 5,463   | 5,261                                       | 7,119   | 22,976                                   |
| Net profit (loss) for the period after tax<br>(after exceptional and/or exna ordinary items)   | 3,376   | 1,910                                       | 1,675   | 8,546                                    | 3,459   | 4,019                                       | 4,590   | 15.242                                   |
| Total Comprehensive Income for the period<br>(Comprising Profit/Loss) for the period (after tax) and<br>Other Comprehensive Income (after tax) | 3,376   | 1,909                                       | 1.675   | 8.454                                    | 3,859   | 4,375                                       | 6.152   | 16.760                                   |
| Equity Share Capital   | 1,430   | 1,430                                       | 1,430   | 1,430                                    | 1,430   | 1,430                                       | 1,430   | 1,430                                    |
| Reserves (excluding Revaluation Reserve as shown in<br>the Audited Balance Sheet of previous year)   | Ra.o  | 7,059/-Lakins a                             | s on 31st March                               | 2022                                     | FIs.96  | 5,087/-Lakhs a                              | s on 31st March                               | 2022                                     |
| Earning per share lof Ps. 2 /- each) (for continuing and discontinued operations)  |   |   |   |  |   |   |   |  |
| Basic  | 4.72  | 2.67  | 2.34  | 11.98                                    | 4.84  | 5.62  | 6.42  | 21.31                                    |
| Diluted  | 4,72  | 2.67  | 2.34  | 11.98                                    | 4,84  | 5.62  | 6.42  | 21.31                                    |

rdards (\*IND AS) notified under section 133 of th

















